

## ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ-ગાંધીનગર

### અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેની અગત્યની જાહેરાત

મંડળની જા.ક. ૧૬૮/૨૦૧૮૧૯ - સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ( ફેબ્રીકેશન ગ્રુપ), વર્ગ-૩ સંવર્ગોની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા અને બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ એમ બંને પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ સંયુક્ત ગુણના મેરીટ્સ તેમજ કેટેગરીવાઈઝ ભરવાની થતી જગ્યાના આધારે પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોની યાદી પ્રસિધ્ધ કરી, યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી તા. ૧૯/૦૧/૨૦૨૧ થી તા. ૨૧/૦૧/૨૦૨૧ ના દરમિયાન કરવામાં આવેલ હતી.

ઉક્ત ચકાસણીમાં કેટલાક ઉમેદવારો ગેર-હાજર રહેતા અને કેટલાક ઉમેદવારો ગેર-લાયક ઠરતાં પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર કેટલાક વધુ સંભવિત ઉમેદવારોની અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવી જરૂરી બનતાં ઉક્ત જાહેરાત/સંવર્ગની યાદીમાં નીચે દર્શાવ્યા મુજબના ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવેલ છે. આ ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી મંડળની કચેરી ખાતે **તા. ૦૨/૦૭/૨૦૨૧ ના રોજ સવારના ૧૧-૦૦ કલાકે** રાખેલ છે. જે અંગે ઉમેદવારોને એપ્લીકેશનમાં દર્શાવેલ ઈ-મેઇલ આઇડી પર પત્ર મોકલવામાં આવેલ છે. અને રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર સંપર્ક કરવામાં આવી રહેલ છે. તેમ છતાં કોઇ ઉમેદવારનો સંપર્ક પ્રમાણપત્રોની ચકાસણીની તારીખ પહેલાં થયેલ ન હોય તો પણ તેવા ઉમેદવારે ઉક્ત ચકાસણીની તારીખ-સમયે અચૂક ઉપસ્થિત રહેવાનું રહેશે. પ્રમાણપત્રોની ચકાસણી સમયે ઉમેદવારોએ સાથે પોતાની જાતિ, વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત, જાહેરાતમાં દર્શાવેલ જરૂરી અનુભવ વગેરેને લગતા અસલ પ્રમાણપત્રો તેમજ તેની બે-બે ઝેરોક્ષ નકલો ( પ્રમાણિત/સ્વપ્રમાણિત) અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો લાવવાનો રહેશે.

જે ઉમેદવાર ઉપર વર્ણવેલ નિયત તારીખે અને સમયે પ્રમાણપત્રોની ચકાસણી માટે ઉપસ્થિત નહીં રહે તો તેવા ઉમેદવારને નોકરીની જરૂરિયાત નથી તેમ માનીને મંડળ દ્વારા તેઓને કોઇપણ પ્રકારની જાણ કર્યા વગર આગળની ભરતી પ્રક્રિયામાંથી પડતા મુકવામાં આવશે. તેમજ તેવા ઉમેદવાર ઉક્ત બંને કસોટી - સ્પર્ધાત્મક લેખિત કસોટી અને કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી કસોટીમાં મેળવેલ ગુણના મેરીટ્સ આધારે પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સ્થાન મેળવવાપાત્ર હશે તો પણ તેઓનો હક્ક આપોઆપ રદ થયેલ ગણવામાં આવશે અને તે સામેની તેઓની કોઇ રજુઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. જેની નોંધ લેવા પણ જણાવવામાં આવે છે.

#### પ્રમાણપત્રોની ચકાસણી માટેનું સ્થળ:-

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, બ્લોક નં. ૨, પહેલો માળ, કર્મયોગી ભવન, નિર્માણભવનની પાછળ, સેક્ટર-૧૦ એ, ગાંધીનગર

જા.ક. ૧૬૮/૨૦૧૮૧૯ - સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (ફેબ્રિકેશન ગ્રુપ), માં પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાના થતા વધારાના ઉમેદવારોની યાદી

LIST OF CANDIDATES CALLED FOR DOCUMENT VERIFICATION (Additional List)				
FOR THE POST OF SUPERVISOR INSTRUCTOR ( FABRICATION GROUP)				
(ADVT. NO. 168/201819 )				
VERIFICATION of AGE, QUALIFICATION, CASTE AND ALL OTHER ELIGIBILITY CRITERIA				
Sr. No.	Roll No. Written Exam	Roll No. Comp. Profi. Exam	Name	Gender
1	168001547	168000011	BHUPENDRAKUMAR BHAILAL VASAVA	M
2	168006318	168000067	MANISHA RATAN YADAV KUMARI	F
3	168002020	168000068	CHIRAYU SURENDRABHAI BARA	M
4	168009055	168000115	RAJKUMAR PRAVINBHAI DADHANIA	M
5	168000889	168000142	ASHISHKUMAR ARJUNBHAI DAMOR	M
6	168012791	168000155	PRAVIN BHAGVANBHAI MER	M
7	168000202	168000179	AKASHKUMAR BABUBHAI CHOVIYA	M
8	168007315	168000266	NEMISHA GOSWAMI	F
9	168012900	168000281	RUPAL HIRENBHAI DHANDHUKIYA	F
10	168011316	168000289	VIKASKUMAR VIJAYKUMAR CHAUDHARI	M
11	168005970	168000326	KUMKUMLATA PRAMODKUMAR PANDEY	F
12	168000774	168000405	APEXABEN ANKIT PATEL	F
13	168007473	168000442	NIKITABEN VIJAYBHAI THAKOR	F

**નોંધ:-** પ્રથમ તબક્કાની ચકાસણીમાં કેટલાક ઉમેદવારો ગેરહાજર/ ગેરલાયક ઠરતાં પસંદગી/પ્રતિક્ષા યાદી માટે પૂરતા લાયક ઉમેદવારો ઉપલબ્ધ ન થતાં બીજા તબક્કામાં અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે જરૂરિયાત કરતાં કેટલાક વધારે ઉમેદવારોને બોલાવવામાં આવેલ છે. તેથી પ્રમાણપત્રોની ચકાસણીને અંતે લાયક ઠરેલ તમામ ઉમેદવારોનો સમાવેશ પસંદગી/પ્રતિક્ષા યાદીમાં થઈ જ જશે તેવું મની લેવાનું રહેશે નહીં. અને તેથી ઉપર દર્શાવેલ યાદીમાં પોતાના નામના સમાવેશ માત્રથી કોઈ ઉમેદવાર તેઓનો પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવેશ માટેનો કોઈ હક્ક દાવો કરી શકશે નહીં.

સ્થળ: ગાંધીનગર  
તા. ૩૦/૦૬/૨૦૨૧

સચિવ  
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ,  
ગાંધીનગર